

**માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના**  
**(વર્ષ-૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવેલ અને આ યોજનામાં અગાઉ**  
**અરજી ન કરેલ હોય એ વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)**

ઠરાવ ક્રમાંક: ૫૨૫/૧૦૨૦૧૪/UOR-૬/ખ

1. ઉક્ત ઠરાવમાં દર્શાવેલ કોઈ-પણ એક કે વધુ ગ્રુપમાં આવતા વિદ્યાર્થીઓ માટે “માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના”માં ફોર્મ ભરવા માટેની વિગતો આ સાથે સામેલ છે.
2. જે વિદ્યાર્થીએ વર્ષ-૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવેલ અને આ યોજનામાં અગાઉ અરજી ન કરેલ હોય એ વિદ્યાર્થીઓએ જ “Delayed Application” પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
3. આ યોજના માટે વિદ્યાર્થીએ વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ તથા પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ હોવી જોઈએ.
4. વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થાના આચાર્યશ્રી પાસેથી સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ મેળવવા માટે જે વર્ષ માટે અરજી કરે તેના અગાઉના વર્ષની પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે અને જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા ૭૫% હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. ([ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે](#))
5. વિદ્યાર્થીએ <https://scholarships.gujarat.gov.in/> પરથી “Delayed Application” પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
6. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષ માટેની જ સહાય મળવાપાત્ર થશે. અગાઉના વર્ષ માટે કોઈ સહાય મળવાપાત્ર થશે નહિ.
7. વિદ્યાર્થીએ વાલીની આવકનું [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#)નું આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. વિદ્યાર્થીએ આપવાના સેલ્ફ ડેકલેરેશનમાં વાલી (માતા-પિતા)ની આવકની વિગતો આપવાની રહેશે.
8. વિદ્યાર્થીએ વાલીની આવકનું [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#)નું ઇન્કમેટેક્સ રિટર્ન અથવા ઇન્કમેટેક્સ રિટર્ન ભરવાપાત્ર ન હોય તેઓએ “ આવકવેરાને પાત્ર આવક નથી હોવાનું સેલ્ફ ડીકલેરેશન” આપવાનું રહેશે. ([ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે](#))
9. જે વાલીઓની [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#)ની આવક રૂ. ૨.૫૦ લાખથી વધારે હશે તેમને ફરજિયાત ઇન્કમેટેક્સ રિટર્ન જોડવાનું રહેશે.

10. સેલ્ફ ડેકલેરેશન, સંસ્થાના આચાર્યશ્રી પાસેથી મેળવવાનું પ્રમાણપત્ર તથા આવકના પ્રમાણપત્રનું ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
11. મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) હેઠળ સીધી જમા થતી હોવાથી વિદ્યાર્થીએ નેશનલાઈઝ્ડ બેન્કમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેન્ક ખાતા સાથે વિદ્યાર્થીએ પોતાનો આધાર નંબર જોડવાનો (seeding) રહેશે.
12. વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા બાદ રાજ્યભરમાં આવેલ ૧૭૬ હેલ્પ સેન્ટરો પૈકી પોતાના અભ્યાસક્રમને સંબંધિત નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે નીચે જણાવેલ સ્વપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. [Acknowledgement Receipt](#) મેળવવાની રહેશે.

- આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ
  - ધો-૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ
  - શાળા છોડ્યાના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ
  - ડીગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વપ્રમાણિત નકલ
  - સેલ્ફ ડેકલેરેશન(અસલમાં)
  - વિદ્યાર્થીના અગાઉના વર્ષની તમામ માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બધા સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
  - ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ (અસલમાં)
  - વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું) સ્વપ્રમાણિત નકલ,
  - સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર (અસલમાં),
  - નેશનલાઈઝ્ડ બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ/કેન્સલડ ચેક
  - ઇન્કમેટેક્સ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડેકલેરેશન (અસલમાં).
- વિદ્યાર્થીએ જે ગુપ સિલેક્ટ કરી અરજી કરી છે, તેનાં પ્રમાણપત્રની નકલ તેમણે રજૂ કરવાની રહેશે તેની યાદી નીચે મુજબ છે. (વિદ્યાર્થીને લાગુ પડતા પ્રમાણપત્રો જ રજૂ કરવાના રહેશે.)
    - a) શ્રમિક કાર્ડ (ચાલુ વર્ષનું)
    - b) સૈનિક વેલફેર બોર્ડનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    - c) વિકલાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર(ચાલુ વર્ષનું)
    - d) જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

- e) માતા પિતા અલગ થયાના પુરાવા (કોર્ટનો ચુકાદો)
- f) માતા/પિતાનું મરણનું પ્રમાણપત્ર
- g) અનાથ આશ્રમનું પ્રમાણપત્ર
- h) વિધવા હોવાનું પ્રમાણપત્ર (ચાલુ વર્ષનું)
- i) ત્યકતા હોવાનું રૂ.૧૦૦ના સ્ટેમ પેપર પર એફિડેવિટ (ચાલુ વર્ષનું)

13. તબીબી અભ્યાસક્રમમાં માત્ર MBSS અભ્યાસક્રમ જ અને અન્ય તમામ અભ્યાસક્રમ જેવા કે ડેન્ટલ , નર્સિંગ ,ફિઝિયોથેરેપી ,આયુર્વેદ વગેરેનો સમાવેશ પેરામેડીકલમાં અભ્યાસક્રમમાં કરવામાં આવશે.
14. પેરામેડીકલ ,તબીબી ,ઈજનેરી વગેરેમાં સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારને જ ટ્યુશન ફીના ૫૦% અથવા મહત્તમ મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
15. યોજનાની વધુ માહિતી હેલ્પ લાઈન નં.૦૭૯-૨૬૫૬૦૦૦, ૭૦૪૩૩૩૩૧૮૧(૧૦:૩૦ થી ૧૮:૦૦ દરમ્યાન) પરથી મળી શકશે અને [cmsskeg2019@gmail.com](mailto:cmsskeg2019@gmail.com) પરથી મળી રહેશે.